

M.A. (PSYCHOLOGY) Semester - 4 (CBCS) Examination
March/April - 2024 (NEW COURSE)
Behavior Modification (Elective-6)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન-૧ બેકની બોધાત્મક ઉપચાર પદ્ધતિ વિગતે સમજાવો. (૧૪)
 અથવા
 પ્રશ્ન-૧ બોધનાત્મક વર્તન સુધારણાની પ્રયુક્તિ તરીકે સમસ્યા ઉકેલની તાલીમની ચર્ચા કરો.
 પ્રશ્ન-૨ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના સબંધો સુધારવા શું કરી શકાય સમજાવો. (૧૪)
 અથવા
 પ્રશ્ન-૨ સ્મૃતિ વધારવા શું કરી શકાય ચર્ચા કરો.
 પ્રશ્ન-૩ કાર્ડિયોલોજી અને ન્યુરોલોજીના ક્ષેત્રમાં વર્તન સુધારણા પ્રયુક્તિ સમજાવો. (૧૪)
 અથવા
 પ્રશ્ન-૩ સ્વાસ્થ્ય સંભાળની જાગૃતિમાં વર્તન ફેરફારની પદ્ધતિની ભૂમિકા સમજાવો.
 પ્રશ્ન-૪ મનોભાર વ્યવસ્થાપન સમજાવો. (૧૪)
 અથવા
 પ્રશ્ન-૪ સંઘર્ષ એટલે શું? સંઘર્ષ વ્યવસ્થાપન સમજાવો.
 પ્રશ્ન-૫ કોઈપણ બે ટુંક નોંધ લખો . (૧૪)
 (૧) સમય વ્યવસ્થાપન
 (૨) પરીક્ષા ભય
 (૩) સર્જનાત્મકતા એટલે શું?
 (૪) મનોચિકિત્સા બેઠક

ENGLISH VERSION

- Que-1 Explain the Back's cognitive therapy. (14)
 OR
 Que-1 Discuss problem solving training as a technique of Cognitive Behaviour Modification.
 Que-2 What Can do for improving relationship between students and teacher. Describe it. (14)
 OR
 Que-2 What can be done to enhance memory discuss about it.
 Que-3 Explain the use of behaviour modification techniques in field of cardiology and Neurology. (14)
 OR
 Que-3 Explain the role of behaviour modification techniques for health care.
 Que-4 Explain the stress management. (14)
 OR
 Que-4 What is conflicts? Explain it's management.
 Que-5 Write any Two short notes. (14)
 (1) Time management.
 (2) Exam phobia.
 (3) What is creativity?
 (4) Psychiatric setting.
